

રાજકોટ મહાનગરપાલિકા
રાજકોટ



2021-22

વોલ્યુમ - ૨ (પ્રાઈસ બીડ)
(Re-Tender)

કામનું નામ:-

રાજકોટ મહાનગરપાલિકાના વોટરવર્ક્સ શાખામાં મિકેનિકલ રીપેરીંગ કામોનો દ્વિ-વાર્ષિક રેઇ કોન્ટ્રાક્ટ.

માઈલસ્ટોન તારીખ	
1. ઈ-ટેન્ડર ડાઉનલોડ કરવાની તારીખ	24-05-2022 to 14-06-2022 up to 18:00 hr
2. ઈ-ટેન્ડર ઓનલાઇન સબમીશન કરવાની છેલ્લી તારીખ	14-06-2022 up to 18:00 hr
3. ઈ.એમ.ડી. ટેન્ડર ફી તથા અન્ય દસ્તાવેજોની ફીઝીકલ સબમીશન કરવાની છેલ્લી તારીખ	17-06-2022 up to 18:00 hr
4. સબમીશન કરાવેલ દસ્તાવેજોની ચકાસણીની તારીખ	18-06-2022
5. ઓનલાઇન ટેકનિકલ બીડ ખોલવાની તારીખ	18-06-2022 (If Possible)
6. ઓનલાઇન પ્રાઈઝ બીડ ખોલવાની તારીખ	21-06-2022 (If Possible)
7. બીડની સમયમર્યાદા	120 Days

Add. City Engineer
Water Works
Rajkot Municipal Corporation
Shree Harisinhji Gohil Bhavan
B/h Big Bazar, 150' Ring road
Rajkot - 360 005

કામનું નામ:- રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ શાખામાં મિકેનિકલ રીપેરીંગ કામનો દ્વિ-વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ.

ઝોન વાઇઝ આવતા હેડ વર્ક્સની ડીટેઇલ

૧. **આજી ઝોન:-** આજી ફીલ્ટર પ્લાન્ટ તથા પમ્પ હાઉસ, લાલપરી તથા રાંદરડા પમ્પીંગ સ્ટેશન, કોઠારીયા હુડકો પમ્પીંગ સ્ટેશન, માર્કેટીંગ યાર્ડ પમ્પીંગ સ્ટેશન, આજી ડેડ વોટર સાઇટ, કોઠારીયા હસ્તકના હેડવર્ક્સ (તિરૂપતિ, સ્વાતિ, કોઠારીયા, ગામતળ, નારાયણ નગર), તથા વિનોદનગર ઈ.એસ.આર. પેડક રોડ સ્વીમીંગ પુલ, ની પમ્પીંગ મશીનરીના રીપેરીંગ-મેઇન્ટેનન્સના કામો.
૨. **બેડી ઝોન:-** બેડી ફીલ્ટર પ્લાન્ટ તથા પમ્પ હાઉસ, ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન, દુધસાગર રોડ પમ્પીંગ સ્ટેશન પરની પમ્પીંગ મશીનરીના રીપેરીંગ-મેઇન્ટેનન્સના કામો.
૩. **ન્યારી-૧ ઝોન:-** ન્યારી ફિલ્ટર પ્લાન્ટ તથા પમ્પ હાઉસ, ન્યારી-૧ ડેમ વાલ્વ ટાવર પમ્પીંગ સ્ટેશન, ન્યારી-૧ ડેમ સીપેજ પમ્પીંગ સ્ટેશન, ન્યારી-૧ વેસ્ટ વીયર (વાગુદડ) પમ્પીંગ સ્ટેશન, ન્યારી-૧ ડેમ ડેડ વોટર પમ્પીંગ સ્ટેશન, ન્યારી ડેમ ગેઇટ, ૧૫૦ ફુટ રીંગ રોડ પમ્પીંગ સ્ટેશન, સીજીત્રાનગર પમ્પીંગ સ્ટેશન, પૂનિતનગર(મવડી) પમ્પીંગ સ્ટેશન, કાલાવડ રોડ અન્ડરપાસ, કાલવાડ રોડ સ્વીમીંગ પુલ, ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન, ઈશ્વરીયા/ખંભાળા પમ્પીંગ સ્ટેશન, વાવડી હસ્તકના પમ્પીંગ સ્ટેશનો, મોટામવા અને, વિશ્વકર્મા પમ્પીંગ સ્ટેશનની પમ્પીંગ મશીનરીના રીપેર મેઇન્ટેનન્સના કામો.
૪. **ભાદર ઝોન:-** ભાદર ડેમ આધારીત રીબડા ફીલ્ટર પ્લાન્ટ, જયુબીલી પમ્પીંગ સ્ટેશન, ગરૂકુળ પમ્પીંગ સ્ટેશન, ગોંડલ પમ્પીંગ સ્ટેશન, ભાદર ડેમ પમ્પીંગ સ્ટેશન, લાલ બહાદુર પમ્પીંગ સ્ટેશન, ભીયરીનાકા પમ્પીંગ સ્ટેશન, બજરંગવાડી પમ્પીંગ સ્ટેશન, રેલનગર પમ્પીંગ સ્ટેશન, જિલ્લા ગાર્ડન પમ્પીંગ સ્ટેશન, નવા ભળેલા માધાપર અને મનહરપર ગામમાં આવેલ મશીનરી, રેસકોર્સ સ્વીમીંગ પુલ, સિંદુરીયા સ્વીમીંગ પુલ તથા સિંદુરીયા બુસ્ટીંગ પમ્પની પમ્પીંગ મશીનરીના રીપેરીંગ-મેઇન્ટેનન્સના કામો.
૫. **રૈયાધાર ઝોન:-** રૈયાધાર ફીલ્ટર પ્લાન્ટ તથા પમ્પ હાઉસ, ન્યારા પમ્પીંગ સ્ટેશન, ઘંટેશ્વર ફીલ્ટર પ્લાન્ટ તથા પમ્પ હાઉસ, રંગપર પમ્પીંગ સ્ટેશન, ન્યારી-૨ વાલ્વ ટાવર, ન્યારી-૨ બ્લેકેટ, નવા ભળેલા ઘંટેશ્વર ગામ પમ્પીંગ સ્ટેશન, ઘંટેશ્વર ગામ અને મુંજકા ગામમાં આવેલ ESR/ GSR ની મશીનરી, જીજાબાઇ મહિલા સ્વીમિંગપુલ (સાધુવાસવાણી રોડ પર) ની પમ્પીંગ મશીનરીના રીપેરીંગ-મેઇન્ટેનન્સના કામો.
૬. **હેન્ડ પમ્પ વિભાગ :** રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ બોરના સબમર્સીબલ પમ્પ સેટનું રીપેરીંગ / મેઇન્ટેનન્સ કામ. રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ જાહેર હેન્ડ પમ્પ / ડીપવેલ પમ્પ રીપેર કરવાનું કામ. રાજકોટ મહાનગરપાલિકાના તમામ બીલ્ડીંગોની પમ્પીંગ મશીનરી, ગાર્ડન, કુવા, જાહેર ફુવારા, અન્ડરપાસ પમ્પીંગ સ્ટેશનો તથા પ્રધુમન પાર્કની પમ્પીંગ મશીનરી રીપેરીંગ-મેઇન્ટેનન્સના કામો. (લેબર વર્ક તથા મીકેનિકલ વર્ક સહિત).

ભાવ ભરનારની સહી તથા સીકકો

ભાવ પત્રક

(દરેક ઝોન માટે ભાવ ભરવા ફરજિયાત છે. આમ ન કરનાર એજન્સીના ભાવ લક્ષમાં રાખવામાં આવશે નહીં.)

કોન્ટ્રાક્ટરનું નામ :

ઈ.એમ.ડી. ડીમાન્ડ ડ્રાફ્ટ નં.....તા.....બેન્ક:.....

અમો / હું શ્રી આથી લખી આપીએ છીએ / આપુ છું કે અમોએ / મેં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના પ્લાન્ટ / પમ્પીંગ સ્ટેશનોમાં મીકેનિકલ રીપેરીંગ / મેઈન્ટેનન્સ કામ ટ્રિ વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જરૂરીયાત મુજબ તાત્કાલીક ધોરણે કરવા માટેની તમામ શરતો તથા સમજૂતી વાંચેલ છે. આ તમામ બાબતો અમોને / મને સંપૂર્ણપણે મંજૂર છે. આ ટેન્ડરની નકકી થયેલ શરતો, નિયમો અને સમજૂતી મુજબ અમો / હું પરિશિષ્ટમાં દર્શાવેલ ભાવથી કામગીરી કરવા ખુશી છીએ/છું.

ઝોન ક્રમ	મીકેનિકલ રીપેરીંગ / મેઈન્ટેનન્સ કામગીરીનું ક્ષેત્ર	પર્સન્ટેઈજ રેઈટ(%)	
		આંકડામાં	શબ્દોમાં
૧.	આજી ઝોન:- આજી ફીલ્ટર પ્લાન્ટ તથા પમ્પ હાઉસ, લાલપરી તથા રાંદરડા પમ્પીંગ સ્ટેશન, , કોઠારીયા હુડકો પમ્પીંગ સ્ટેશન, માર્કેટીંગ યાર્ડ પમ્પીંગ સ્ટેશન, આજી ડેડ વોટર સાઈટ, કોઠારીયા હસ્તકના હેડવર્કસ (તિરૂપતિ, સ્વાતિ, કોઠારીયા, ગામતળ, નારાયણ નગર), તથા વિનોદનગર ઈ.એસ.આર, પેડક રોડ સ્વીર્મીંગ પુલ, ની પમ્પીંગ મશીનરીના રીપેરીંગ-મેઈન્ટેનન્સના કામો.	Only Online	
૨.	બેડી ઝોન:- બેડી ફીલ્ટર પ્લાન્ટ તથા પમ્પ હાઉસ, ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન, દુધસાગર રોડ પમ્પીંગ સ્ટેશન પરની પમ્પીંગ મશીનરીના રીપેરીંગ-મેઈન્ટેનન્સના કામો.		
૩.	ન્યારી-૧ ઝોન:- ન્યારી ફીલ્ટર પ્લાન્ટ તથા પમ્પ હાઉસ, ન્યારી-૧ ડેમ વાલ્વ ટાવર પમ્પીંગ સ્ટેશન, ન્યારી-૧ ડેમ સીપેજ પમ્પીંગ સ્ટેશન, ન્યારી-૧ વેસ્ટ વીયર (વાગુદડ) પમ્પીંગ સ્ટેશન, ન્યારી-૧ ડેમ ડેડ વોટર પમ્પીંગ સ્ટેશન, ન્યારી ડેમ ગેઇટ, ૧૫૦ ફુટ રીંગ રોડ પમ્પીંગ સ્ટેશન, સોજીત્રાનગર પમ્પીંગ સ્ટેશન, પૂનિતનગર(મવડી) પમ્પીંગ સ્ટેશન, કાલાવડ રોડ અન્ડરપાસ, કાલાવડ રોડ સ્વીર્મીંગ પુલ, ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન, ઈશ્વરીયા/ખંભાળા પમ્પીંગ સ્ટેશન, વાવડી હસ્તકના પમ્પીંગ સ્ટેશનો, મોટામવા અને, વિશ્વકર્મા પમ્પીંગ સ્ટેશનની પમ્પીંગ મશીનરીના રીપેર મેઈન્ટેનન્સના કામો.	Only Online	
૪.	ભાદર ઝોન:- ભાદર ડેમ આધારીત રીબડા ફીલ્ટર પ્લાન્ટ, જયુબીલી પમ્પીંગ સ્ટેશન, ગરૂકુળ પમ્પીંગ સ્ટેશન, ગોંડલ પમ્પીંગ સ્ટેશન, ભાદર ડેમ વાલ્વ ટાવર પમ્પીંગ સ્ટેશન, લાલ બહાદુર પમ્પીંગ સ્ટેશન, ભીયરીનાકા પમ્પીંગ સ્ટેશન, બજરંગવાડી પમ્પીંગ સ્ટેશન, રેલનગર પમ્પીંગ સ્ટેશન, જિલ્લા ગાર્ડન પમ્પીંગ સ્ટેશન, નવા ભળેલા માધાપર અને મનહરપર ગામમાં આવેલ મશીનરી, રેસકોર્સ સ્વીર્મીંગ પુલ, સિંદુરીયા સ્વીર્મીંગ પુલ તથા સિંદુરીયા બુસ્ટીંગ પમ્પની પમ્પીંગ મશીનરીના રીપેરીંગ-મેઈન્ટેનન્સના કામો.	Only Online	

પ.	<p>રૈયાધાર ઝોન:- રૈયાધાર ફીલ્ટર પ્લાન્ટ તથા પમ્પ હાઉસ, ન્યારા પમ્પીંગ સ્ટેશન, ઘંટેશ્વર ફીલ્ટર પ્લાન્ટ તથા પમ્પ હાઉસ, રંગપર પમ્પીંગ સ્ટેશન, ન્યારી-૨ વાલ્વ ટાવર, ન્યારી-૨ બકેટ, નવા ભળેલા ઘંટેશ્વર ગામ પમ્પીંગ સ્ટેશન, ઘંટેશ્વર ગામ અને મુંજકા ગામમાં આવેલ ESR/ GSR ની મશીનરી, જીજાબાઇ મહિલા સ્વીમિંગપુલ (સધુવાસ્વાણી રોડ પર) ની પમ્પીંગ મશીનરીના રીપેરીંગ-મેઇન્ટેનન્સના કામો.</p>	<p style="text-align: center;">Only Online</p>
૬	<p>હેન્ડ પમ્પ વિભાગ : રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ બોરના સબમર્સીબલ પમ્પ સેટનું રીપેરીંગ / મેઇન્ટેનન્સ કામ. રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ જાહેર હેન્ડ પમ્પ / ડીપવેલ પમ્પ રીપેર કરવાનું કામ. રાજકોટ મહાનગરપાલિકાના તમામ બીલ્ડીંગોની પમ્પીંગ મશીનરી, ગાર્ડન, કુવા, જાહેર કુવારા, અન્ડરપાસ પમ્પીંગ સ્ટેશનો તથા પ્રધુમન પાર્કની પમ્પીંગ મશીનરી રીપેરીંગ-મેઇન્ટેનન્સના કામો. (લેબર વર્ક તથા મીકેનિકલ વર્ક સહિત).</p>	<p style="text-align: center;">Only Online</p>

- નોંધ:-૧). આ કોન્ટ્રાક્ટના સમયગાળામાં, કોઈ પણ નવા પમ્પીંગ સ્ટેશનો કે નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ હોય, અને તેનું ઓપરેશન-મેઇન્ટેનન્સ કરવાનું થાય તો જે તે સંબંધિત ઝોનમાં ઉમેરવાનું રહેશે, જેના માટે કોઈ નવા ભાવો આપવાના રહેશે નહિ.
- ૨). ઉપરોક્ત ઝોનમાં દર્શાવેલ હયાત પમ્પીંગ સ્ટેશન અન્ય ઝોનમાં ફેરવવા અંગે શાખા અધિકારીશ્રી જે-તે સમયે નિર્ણય કરશે તે બંધનકર્તા રહેશે.

સાક્ષીનું નામ:

સરનામું :

તારીખ:

સ્થળ:

ભાવ ભરનારની સહી તથા સીકકો

:: શરતો ::

૧. ૧. ભાવ પત્રક નિયત નમુના મુજબ માત્ર ઓનલાઇન રજુ કરવાનું રહેશે.
૨. પેઢી કે ભાગીદાર વતી સહી કરો તો તે જ પ્રમાણે સહી કરવી.
૩. નિયત થયેલ જગ્યાએ લખવું.
૪. છેકછાકવાળું ટેન્ડર રદ કરવામાં આવશે.
૫. શરતો એબસ્ટ્રેક તથા સમજૂતીમાં દરેક પેઝ પર સહી કરવી.
૬. અર્નેસ્ટ મની ભર્યાનો દાખલો ટેન્ડરના કવર ઉપર ડીમાન્ડ ડ્રાફ્ટ પહોંચ નંબર / તારીખથી લખવી. ડીમાન્ડ ડ્રાફ્ટ ટેન્ડર સાથે રાખવો.
૨. કામ માટેની જાણ સાર્ફટ એન્જીનિયર અથવા તેઓના ટેકનીકલ કર્મચારી દ્વારા પ્રથમ ટેલીફોનિક કરવામાં આવશે. કામ ખરા ખંતથી થવું જોઈએ અને કરેલું સઘળું કામ કારીગરની રીતે કરેલું હોવું જોઈએ. ટેન્ડર રજુ કરનાર શપ્સ / શપ્સો જે માલ સામાન વાપરે તે ઉત્તમ પ્રકારનો હોવો જોઈએ. લેખીત તેમજ મૌખિક સુચના તેમજ નોટીસ આપવા છતાં પણ કામની ગતિ કે ઝડપ વધારવામાં નહીં આવે તો કમિશનરશ્રીને કાન્ટ્રાક્ટ રદ કરવાનો અધિકાર રહેશે.
૩. કોન્ટ્રાક્ટરે પોતાના કામદારોને થયેલ ઈજા માટે તથા તેને કંઈ વળતર આપવું પડે તો તે માટે તમામ રીતે કોન્ટ્રાક્ટર જવાબદાર રહેશે. કામે રાખનાર કર્મચારીઓનો વિમો રાષ્ટ્રીયકૃત સંસ્થાનો ઉતારવાનો રહેશે.
- ૪.એ. આમાં કબુલ કરેલી તેવી તમામ કામની જુદી જુદી બાબતો માટેનો દરજજો તે બાબતો મંજૂર કરેલી સમજૂતી અનુસાર પુરી કરવામાં આવી છે એમ સ્વીકારવામાં આવે તો જ કાયદેસર ગણાશે, જે તે પ્રસંગે કામની સદરહુ બાબતો એવી રીતે પુરી કરી છે એમ સ્વીકારવામાં નહીં આવે તે પ્રસંગે સીટી એન્જીનીયરશ્રી છેવટના બીલો તૈયાર કરતી વખતે વ્યાજબી લાગે તેવા ઘટાડાના દરથી બીલો કરવા મુખત્યાર છે.
- બી. જો કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે કોઈ પણ પર્મીંગ સ્ટેશન ઉપર રીપેરીંગમાં વિલંબ થશે તો કામગીરીની અગત્યતા/ઈમરજન્સી લક્ષ્યમાં લઈ નિયમાનુસાર પેનલ્ટી વસુલ કરવામાં આવશે, જે અંગે શાખા અધિકારીશ્રી નો નિર્ણય આખરી ગણાશે જે કોન્ટ્રાક્ટરને બંધનકર્તા રહેશે.
૫. વર્ક ઓર્ડર મળે તુરત જ કામ ચાલુ કરવાનું છે. ઓર્ડરમાં જણાવેલ મુદત દરમ્યાન કામગીરી કરવાની છે. જો મુદત દરમ્યાન સુચના પ્રમાણે કામ કરવામાં નહીં, આવે તો શાખા અધિકારીશ્રી ને યોગ્ય લાગશે તો કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે અન્ય કોન્ટ્રાક્ટર પાસે અગર તો ખાતા મારફત કામ પુરું કરાવાશે. અને આમ બાકી રહેતું કામ પુરું કરવામાં મહાનગરપાલિકાને કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ કરતા જો વધુ ખર્ચ થશે તો તે કોન્ટ્રાક્ટર પાસેથી કાયદેસર રીતે આ વધારાનો ખર્ચ વસુલ કરવામાં આવશે તથા તેની સીક્યોરીટી ડીપોઝીટ જપ્ત કરી શકાશે. શાખા અધિકારીશ્રી ને જો યોગ્ય લાગશે તો વિશેષ મુદત માટે કોન્ટ્રાક્ટર પાસેથી કામ ચાલુ રખાવી શકાશે અને તેની મુદત સંજોગોને લક્ષ્યમાં રાખીને વધારી આપશે.
૬. વર્ક ઓર્ડરમાં જણાવ્યા તારીખે કામ પુરું કરવા કોન્ટ્રાક્ટર નિષ્ફળ જાય તો અગાઉ નિયમ-૪ પ્રમાણે પેનલ્ટી વસુલ લેવામાં આવશે. જો મહાનગરપાલિકાને કારણે સંજોગો અનુસાર કામ બંધ રહે તો જેટલા દિવસ કામ બંધ રહે તેટલા દિવસની મુદત આપવામાં આવશે અથવા તો કોઈ કારણસર કામ બંધ રહે તેની જાણ કોન્ટ્રાક્ટરે મહાનગરપાલિકાના ઈજનેરને કરવાની રહે છે અને જો વ્યાજબી કારણ લાગશે તો વધારાની મુદત માટે કમિશનરશ્રી વિચારશે અને તેનો નિર્ણય આખરી ગણાશે.

૭. કામગીરી દરમ્યાન માલ સામાન નડતરરૂપ ન થાય તે રીતે કામગીરી કરવાની રહેશે.
૮. ટેન્ડર સ્વીકારવામાં આવે ત્યાર બાદ અઠવાડિયાની અંદર સીક્યોરીટી ડીપોઝીટ દરેક ઝોન દીઠ રૂા.૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ લાખ પુરા) ડીમાન્ડ ડ્રાફ્ટ અથવા બેંક ગેરેંટીના સ્વરૂપે રકમ ભરી રૂ. ૩૦૦/- કિંમતના સ્ટેમ્પ પેપર પર એજન્સીએ કરારનામુ કરવાનું રહેશે. એજન્સી સીક્યોરીટી ડીપોઝીટ FDR ના સ્વરૂપે જમા કરાવશે તો સીક્યોરીટી ડીપોઝીટની રકમના ૪.૯૦% લેખે થતી કિંમતના સ્ટેમ્પ પેપર પર એજન્સીએ કરારનામુ કરવાનું રહેશે. જો આમ કરવામા ટેન્ડર રાખનાર શપ્સ નાકામિયાબ નીવડશે તો તેણે ભરેલ અર્નેષ્ટ મનીની રકમ જપ્ત કરવામાં આવશે. અને તે શપ્સના ખર્ચે અને જોખમે ફરીથી ટેન્ડરની માગણી કરવામાં આવશે.
૯. સીક્યોરીટી ડીપોઝીટ તરીકે ભરેલ રકમ કામ પુરુ થઈ ગયા બાદ ત્રણ માસ પછી તથા કોન્ટ્રાક્ટરને ફાઈનલ બીલ મળ્યા બાદ પાછી આપવામાં આવશે, પરંતુ તે સમય દરમ્યાન કોઈ કામ અથવા મશીનરી ખરાબ થયેલ અથવા નુકશાન પામેલ માલુમ પડશે તો તે કામ કોન્ટ્રાક્ટરે દુરસ્ત કરી આપવાનું રહેશે. અને જો તેમ કરવામાં નાકામિયાબ નીવડશે તો દુરસ્તી તેને ખર્ચે અને જોખમે મહાનગરપાલિકા તરફથી કરાવી લેવામાં આવશે, અને તે પૈકીના થયેલ ખર્ચ સીક્યોરીટી ડીપોઝીટની રકમમાંથી કાપી લેવામાં આવશે. જે ફાઈનલ બીલ સમયે ચુકવવામાં આવશે.
૧૦. કોન્ટ્રાક્ટરે અઢાર વર્ષથી ઓછી ઉમરનાં કોઈ વ્યક્તિને કામે લગાડવા નહી. તેમજ કોન્ટ્રાક્ટર તરફથી રાખવામાં આવેલ કોઈ પણ સ્કીલ કે અનસ્કીલ કર્મચારીની વર્તાણુક વ્યવહાર યોગ્ય નહી જણાય તો આવા કર્મચારીને નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી / શાખા અધિકારીશ્રી મૌખિક કે લેખીત સુચના આપે તે પ્રમાણે કામ ઉપરથી દુર કરવાના રહેશે. અને જે કર્મચારીને રાખવાની શાખા અધિકારીશ્રી મનાઈ કરે તે કર્મચારીને રાખવાના રહેશે નહી.
૧૧. કામ ઉપર કોન્ટ્રાક્ટરે પોતે અથવા તેના વતી જવાબદાર માણસને હાજર રાખવાનો રહેશે.
૧૨. વર્ક ઓર્ડર આપી કામમાં ચાલુ કામે અન્ય આસામીઓની મિલકતને અગર જાનમાલને કોઈપણ નુકશાન થશે તો તેની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે. અને તે માટે કોઈપણ વળતરની રકમ ચુકવવાની થાય તો તે કોન્ટ્રાક્ટરે ભરી આપવાની રહેશે. જો કોન્ટ્રાક્ટર અમલ ન કરે તો તેવા વળતર વિગેરેની રકમ તેના બીલોમાંથી કાપી લેવામાં આવશે.
૧૩. કોઈપણ કારણોસર કોન્ટ્રાક્ટર ટેન્ડરમાં દર્શાવેલ કામ કરવા અશક્તિમાન થશે તો મહાનગરપાલિકા તેના ખર્ચે અને જોખમે આ કામ પુરુ કરાવશે. અને આમ કરતા ટેન્ડરમાં જણાવેલ ભાવ કરતાં વધારે ખર્ચ થશે તો મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરની સીક્યોરીટીમાંથી કે સાઈટ ઉપર પડેલા માલ સામાનની હરરાજી કરી ખર્ચ વસુલ કરી શકશે અને તેમ કરતાં કોન્ટ્રાક્ટરનો કોઈ પણ વાંધો કે હકક રહેશે નહી.
૧૪. આ કામનો કોઈ પણ ભાગ સંતોષકારક રીતે કોન્ટ્રાક્ટર નહી કરે તો મહાનગરપાલિકાનાં ઈજનેર તેઓને કામ સુધારવા નોટીસ આપશે. મુદત વિત્યા બાદ મહાનગરપાલિકાનાં ઈજનેર કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે માણસો રાખી તેમજ માલ સામાન ખરીદી કામ કરવાની કાર્યવાહી કરશે અને કોન્ટ્રાક્ટર પાસેથી ખર્ચ વસુલી કરશે. આ કામ શાખા અધિકારીશ્રી બીજા કોન્ટ્રાક્ટર પાસે પણ કરાવી શકશે.
૧૫. શ્રી કમિશનરશ્રીનાં હાથથી અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારીનાં હાથથી ટેન્ડરો ખોલવામાં આવશે ત્યારથી એકસો વીસ (૧૨૦) દિવસમાં ટેન્ડર સ્વીકારવામાં આવેલ છે કે નહી તેનો નિર્ણય શ્રી કમિશનરશ્રી મારફત કરવામાં આવશે. આ મુદતમાં જો કોઈ પણ પ્રકારનાં નિર્ણયની જાણ કોન્ટ્રાક્ટરને કરવામાં નહી આવે તો ટેન્ડરનાં ભાવો કોન્ટ્રાક્ટર કે મહાનગરપાલિકાને બંધનકર્તા રહેશે નહી પરંતુ કોન્ટ્રાક્ટર અને કમિશનરશ્રી બંનેની સહમતીથી આવેલ ભાવોનું ટેન્ડર મંજુર કરવા માટે કમિશનરશ્રી નિર્ણય કરી શકશે.

૧૬. રીપેરીંગ / જોબ કામ માટેના ભાવ તમામ પ્રકારના ટેકસ સિવાયના આપવાના રહેશે.
 ૧૭. આ કામગીરી માટે એક અથવા એકથી વધારે એજન્સી નક્કી કરવાની સત્તા અબાધિત રાખવામાં આવે છે. જે તમામ ભાવ ભરનારને બંધનકર્તા રહેશે.
 ૧૮. પર્મીંગ સ્ટેશન ઉપર કામ કરનાર કોન્ટ્રાક્ટરનાં કોઈ પણ કર્મચારી મહાનગરપાલિકાના કર્મચારી ગણાશે નહીં. તેમજ તે મુજબના કોઈ હકક દાવા રજુ કરી શકશે નહીં જે અંગેની સંપૂર્ણ જવાબદારી સંબંધીત કોન્ટ્રાક્ટરની રહેશે.
 ૧૯. ભાવ ભરનાર એજન્સી પાસે ટેલીફોન તથા મોબાઇલ ફોન હોવા આવશ્યક છે. જેના નંબર અલગથી ટેન્ડર સાથે આપવા. મોબાઇલ ફોન અથવા વર્કશોપના ફોન બદલાઈ જાય તેવા સંજોગોમાં તાત્કાલીક નવા નંબરો સંબંધક અધિકારીને આપવા.
 ૨૦. આ કામે ભાગ લેનાર એજન્સીને મહત્તમ ૦૨ (બે) ઝોનનું કામ આપવામાં આવશે. જે તમામ ભાવ ભરનાર એજન્સીઓને બંધનકર્તા રહેશે.
 ૨૧. ટ્રિ-વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટની મુદત દરમિયાન કોઈ પણ પ્રકારના પ્રશ્ન અંગે શાખા અધિકારીશ્રીનો નિર્ણય આખરી રહેશે.
 ૨૨. ઉપરોક્ત જનરલ સમજૂતી સિવાય ટેન્ડરમાં આપેલ શરતોને આધીન રહીને કામ કરવાનું રહેશે.
- ઉપર મુજબની તમામ શરતો અમોએ વાંચી સમજીને આ નીચે સહી કરી આપી છે જે અમોને કબુલ મંજૂર છે.

કોન્ટ્રાક્ટરની સહી તથા સીકકો

:: ખાસ શરતો ::

૧. પરિશિષ્ટ-૧ માં દર્શાવેલ કામગીરી સિવાયની કામગીરી દરમ્યાન, જરૂરીયાત મુજબના નટ બોલ્ટ્સ, સ્ટડ્સ અનબ્રેકો, ટી.વી.એસ., એસ.એફ.પી.એલ., ઉષા વગેરે મેઈક પૈકીના હાઈટેન્સાઈલ ગ્રેડના તેમજ સ્પ્રીંગ વોશર ૪-બી મેઈકના તથા જરૂરત મુજબના સ્કવેર સેક્શન અથવા ફ્લેટ વાપરવાના રહેશે અને તે માટે થનાર ખર્ચ પ્રતિ કિલોગ્રામ મુજબ અલગથી ચુકવવામાં આવશે.
૨. કામગીરી માટે સાઈટ પર ફીટ કરવામાં આવેલ ગેન્ટ્રી તથા ચેઈનપુલી બ્લોકનો ઉપયોગ મહાનગરપાલિકા તરફથી કરવા દેવામાં આવશે. બાકી તમામ જરૂરી ટુલ્સ, ટેકલ્સની વ્યવસ્થા કોન્ટ્રાક્ટરશ્રીએ કરવાની રહેશે.
૩. કામગીરી દરમ્યાન કોન્ટ્રાક્ટરશ્રી ના ટુલ્સ ટેકલ્સ ઈન્ટેક વેલમાં / બોરમાં પડી જશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે.
૪. કામગીરી દરમ્યાન મહાનગરપાલિકાની સાઈટ પરની અન્ય મશીનરી કે માલ મિલકતને નુકશાન થાય તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરશ્રીની રહેશે. જે કોન્ટ્રાક્ટરને માન્ય રાખવાનું બંધનકર્તા છે.
૫. આ પ્રકારની કામગીરી આવશ્યક સેવા અંતર્ગત હોય જરૂરીયાતને ધ્યાને લઈ ફરજ ઉપરના કર્મચારી કે અધિકારી જાણ કરે ત્યારે તાકીદના ધોરણે કામ ચાલુ કરવાનું રહેશે અને કામગીરી માટે સાઈટ પર જવા-આવવાની વ્યવસ્થા કોન્ટ્રાક્ટરશ્રીએ કરવાની રહેશે.
૬. ઉપરોક્ત પમ્પ સેટ ખોલવા તથા ફીટ કરવા માટે સ્પેશિયલ ટાઈપ લાગલુગ / પુલર / કલેમ્પ વગેરેની જરૂરીયાત પડે તો જે તે એજન્સીએ પોતાના ખર્ચે બનાવવાના રહેશે. આ કામે રાજકોટ મહાનગરપાલિકા તરફથી વધારાનું ચુકવણું કરવામાં આવશે નહીં.
૭. કોન્ટ્રાક્ટરનાં સ્ટાફની બેદરકારીને કારણે મશીનરીને નુકશાન થાય, તો રીપેરીંગ ખર્ચ કોન્ટ્રાક્ટરે ભોગવવાનો રહેશે. આ પ્રકારની નુકશાનીની જવાબદારી સંબંધીત ઈન્ચાર્જ એન્જીનીયર નક્કી કરશે. જે કોન્ટ્રાક્ટરને માન્ય રાખવું બંધનકર્તા છે.
૮. કોઈ પણ પ્રકારના ફોલ્ટ રીપેરીંગની જાણ તાત્કાલીક સંબંધીત એજન્સીને ટેલીફોનથી કરવામાં આવે એટલે એજન્સીએ ઈમરજન્સી ધોરણે રીપેરીંગ કામ કરી આપવાનું રહેશે. આ દરમ્યાન વીજળી પુરવઠો ખોરવાઈ ગયેલો હશે તેવા સંજોગોમાં એજન્સીએ પાવર સપ્લાય માટે ડી.જી. સેટની વ્યવસ્થા કરવાની રહેશે. ડી. જી. સેટ ઉપયોગમાં લઈએ તો વધારાનું અલગથી ચુકવણુ, વોટર વર્ક્સ SOR + એજન્સી દ્વારા રજુ થયેલ + પર્સન્ટેજ મુજબ કરવામાં આવશે..
૯. રૂટીન મેઈન્ટેનન્સ તથા ચેક ફોલ્ટ મેઈન્ટેનન્સ માટે જરૂરી જીગ્સ એન્ડ ફીક્સચર્સ (લાગલુગ) તેમજ ટુલ કીટ જેમ કે ફીક્સ / રીંગ સ્પેનર સેટ, ટેસ્ટર, ડીસમીસ સેટ, ઈન્સ્યુલેટેડ પકક્ડ વગેરે એજન્સીએ પોતાના રાખવાના થશે.
૧૦. મિકેનીકલ રીપેરીંગ બાદ સંતોષકારક ૨૪ કલાકનું ટેસ્ટીંગ તથા ૧૫ દિવસની કરવામાં આવેલ રીપેરીંગ કામની ગેરંટી આપવાની રહેશે. આ દરમ્યાન જો કોઈ પણ મીકેનીકલ યુનિટને નુકશાન / અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે એજન્સીની રહેશે. આ અંગે અલગથી કોઈ ચુકવણું કરવામાં આવશે નહીં.
૧૧. મિકેનીકલ રીપેરીંગ કામ દરમ્યાન કોઈ પણ પાર્ટ્સમાં નુકશાની થશે તે જે તે એજન્સીએ પોતાના ખર્ચે રીપેર કરી આપવાનું થશે અથવા પાર્ટ્સ નવા ખરીદી કરી ફીટીંગ કરી આપવાના થશે.
૧૨. રીપેરીંગ કામે એજન્સી તરફથી નવા બનાવેલ/સપ્લાય કરેલ માલની અવેજમાં યુનિટમાંથી જુના નીકળેલા માલ કે સ્પેર પાર્ટ રા.મ.ન.પા.ને પરત આપવાના રહેશે નહીં તથા તે જુના માલની માલિકી એજન્સીની રહેશે. (પમ્પ, ગીઅર બોક્સ, વાલ્વ, કમ્પ્રેશર, NRV, વગેરે જેવા મોટા યુનિટ બદલવાના કામમાં જુના યુનિટ માટે એજન્સીની માલિકી રહેશે નહિ)
૧૩. પમ્પના કેસીંગ તથા વાલ્વને ફીટ કરવા માટે જરૂરી ગ્યાસકેટ તથા જરૂરી પેકીંગ, નટ-બોલ્ટ, વોશર વિગેરે એજન્સીએ પોતાના ખર્ચે નાખવાના રહેશે.

૧૪. મિકેનિકલ રીપેરીંગ કામ માટે એજન્સીએ સાઈટ પર કામગીરી કરવાની થશે. પરંતુ જો કોઈ સંજોગોમાં યુનિટને અન્યત્ર વર્કશોપમાં લઈ જવાનું થાય તેવા સંજોગોમાં મહાનગરપાલિકા પાસે વાહન ઉપલબ્ધ હશે તો આપણે અન્યથા એજન્સીએ વાહનની વ્યવસ્થા કરવાની રહેશે જેનું ભાડું વોટર વર્ક્સ શાખાના એસ.ઓ.આર. માં દર્શાવ્યા મુજબ ચુકવવામાં આવશે. શહેરની હદ બહારનાં કીસ્સામાં ભાડું ૧.૫ ગણુ રહેશે.
- સાઈટ પરની તમામ રીપેરીંગ કામગીરી માટે તથા રીપેરીંગ કરવાના યુનિટને લાવવા લઈ જવા માટેની મજૂરીની વ્યવસ્થા ની જવાબદારી એજન્સીએ કરવાની રહેશે, આ માટે અલગ થી કોઈ ચુકવણુ કરવામાં આવશે નહીં.
૧૫. શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ બોરમાંથી સબમર્સીબલ પમ્પ સેટ કાઢવા / ઉતારવાના કામે જરૂરી સાધન સામગ્રી /યાંત્રીક ઘોડી વિગેરે લાવવા લઈ જવા ટ્રાન્સપોર્ટેશન માટે વોટર વર્ક્સ શાખાના એસ.ઓ.આર. મુજબ ભાડું ચુકવવામાં આવશે.
૧૬. આ કામે જણાવેલ મીકેનિકલ કામમાં જે પાર્ટસ વજનથી આપવાના છે તેનું વજન મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીશ્રી / કર્મચારીની હાજરીમાં કરાવવાનું રહેશે.
૧૭. આ કામે ભાવ ભરનાર એજન્સી પાસે વર્કશોપ પોતાની માલિકીનું અથવા ભાડાનું હોવું જરૂરી છે. વર્કશોપમાં લેથ મશીન, ડ્રીલીંગ મશીન, ગ્રાઈન્ડર, વેલ્ડીંગ પ્લાન્ટ વગેરે મશીનરી તથા જીગ્સ ફિક્સચર લાગણુ વગેરે હોવા જરૂરી છે.
૧૮. સાઈટ એન્જીનીયરને જરૂર જણાશે તો મટીરીયલ્સ ટેસ્ટ રીપોર્ટ માંગવામાં આવશે જે અંગે માન્ય લેબોરેટરીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ કામે સંસ્થાને મહાનગરપાલિકાએ ખરેખર થયેલ ખર્ચનું અલગથી ચુકવણું આપવાનું રહેશે. મટીરીયલ્સનો નમુનો એજન્સીએ ઈન્ચાર્જ એન્જીનીયરની હાજરીમાં અત્રેથી સુચવવામાં આવે તે લેબોરેટરીમાં લાવવા લઈ જવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.
૧૯. ઈન્ચાર્જ એન્જીનિયર સુચવે તે મટીરીયલના ગ્રેડમાંથી જરૂરી પાર્ટસ બનાવી આપવાનો રહેશે.
૨૦. પરીશીષ્ટ માં દર્શાવ્યા સિવાયના પમ્પીંગ સ્ટેશન અથવા બોર / કુવાના પમ્પ સેટ રીપેરીંગ કામનો સમાવેશ સીટી એન્જીનિયરશ્રી સુચવે એ ઝોનને ફાળવવામાં આવશે જે કોન્ટ્રાક્ટરને બંધનકર્તા રહેશે.
૨૧. કોઈ પણ કામ સંતોષકારક રીતે કરેલ નહીં જણાય તો તેનું રીપેર કામનું બીલ આકારી રકમ ચુકવવામાં આવશે નહીં. અને તે બીજી વખત સંતોષકારક રીપેર કરી આપવાનું રહેશે.
૨૨. ટેન્ડરમાં સમાવિષ્ટ કર્યા સિવાયની કોઈ આઈટમની જરૂરીયાત ઉપસ્થિત થાય તો એજન્સીએ જરૂરીયાત પુરી પાડવાની રહેશે, જેનું ચુકવણુ રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ/ વોટર વર્ક્સ/ સેન્ટ્રલ સ્ટોર વિગેરેના રનીંગ એસ.ઓ.આર.માં સમાવિષ્ટ ભાવો મુજબ કરવામાં આવશે. આ ચુકવણામાં એજન્સીએ ભરેલ ± પર્સન્ટેજ ધ્યાને લઈ ચુકવણુ કરવામાં આવશે.
૨૩. ટેન્ડરમાં સમાવિષ્ટ કર્યા સિવાયની કોઈ પણ પ્રકારની મિકેનિકલ રીપેરીંગ કામગીરી તથા તેને લગત ફેબ્રિકેશન/પાર્ટસ રીપ્લેસમેન્ટની કામગીરી સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી મેળવી માર્કેટ રેઈટ/કવોટેશન મુજબ કરી શકાશે અને આવા કામો માટે માર્કેટ રેઈટ/કવોટેશન + ૧૦% કોન્ટ્રાક્ટરનો નફો મુજબ ચુકવવામાં આવશે. આ ચુકવણામાં એજન્સીએ ભરેલ ± પર્સન્ટેજ ધ્યાને લઈ ચુકવણુ કરવામાં આવશે નહીં.
૨૪. ટેન્ડરમાં સમાવેશ ન હોય તેવી, મીકેનિકલ રીપેરીંગ કામ સબબ બેરીંગ/ઓઈલ-ગ્રીસ/વી બેલ્ટ કે કોઈ પણ સ્પેર-પાર્ટસ બદલવાના થાય ત્યારે જે કંપનીના બેરીંગ બદલવાની સુચના ઈનચાર્જ એન્જીનીયર દ્વારા આપવામાં આવે તે મુજબ બદલાવી આપવાનું રહેશે તથા તે માટેનું ચુકવણુ જે-તે મુળ ઉત્પાદક કંપનીના પ્રાઈઝ લીસ્ટ મુજબ ચુકવણુ કરવામાં આવશે તથા આ ચુકવણા પર એજન્સીએ ભરેલ ± પર્સન્ટેજ ધ્યાને લેવામાં આવશે નહીં.
૨૫. ઉપરોક્ત શરત નં ૨૪ માં મૂળ ઉત્પાદક કંપનીના પ્રાઈઝ લીસ્ટમાં ભાવ જે રીતે દર્શાવવામાં આવેલ હોય, (GST સહિતનો ભાવ કે GST સિવાયનો ભાવ) તે મુજબ અત્રેથી ચુકવણુ કરવામાં આવશે.

૨૬. એજન્સીની કામગીરી સંતોષકારક જણાયે આ કામના પાર્ટ બીલ દર ૩૦ દિવસે બનાવી ધોરણસર ચુકવણું કરવામાં આવશે.
૨૭. કામગીરીની અગત્યતા તથા ચોકસાઈને લક્ષ્યમાં લઈ ખાસ કિસ્સામાં ના.કા.ઈ.શ્રી પોતાના ઝોનના મંજૂર થયેલ ભાવ પ્રમાણે અન્ય ઝોનના કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવી શકશે.
૨૮. કોઈ પણ પાર્ટર્સનું જરૂર જણાયે ડાયનેમિક બેલેન્સીંગ કરાવવાનું થાય ત્યારે લેબોરેટરીનું ટેસ્ટ સર્ટીફિકેટ રજૂ કરવાનું રહેશે.
૨૯. એજન્સીને ચુકવવામાં આવતા બીલ પર શરત નં ૨૫ ને ધ્યાનમાં રાખી પ્રવર્તમાન GST કે અન્ય TAX ચુકવવામાં આવશે. જે માટે કોન્ટ્રાક્ટર દ્વારા GST કે અન્ય TAX દર્શાવતું ઇનવોઇસ ફરજિયાત રજૂ કરવાનું રહેશે.

હેન્ડ પમ્પ રીપેરીંગ ઝોનના કામની અગત્યની સુચના:

૦૧. એ. હેન્ડ પમ્પ રીપેરીંગ કામ ફક્ત મજૂરી કામ છે. આ કામે વાપરવાનો થશે તે માલ સામાન રાજકોટ મહાનગરપાલિકા તરફથી આપવામાં આવશે.
- બી. આ કામે રાજકોટ મહાનગરપાલિકાના એજન્સીયરીંગ સ્ટોરમાં જરૂરી માલ સામાન ઉપલબ્ધ ન હોઈ તેવા સંજોગોમાં કામગીરીની અગત્યતાને લક્ષ્યમાં રાખી નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની મંજૂરીથી જરૂરી માલ સામાન એજન્સીએ ઉપલબ્ધ કરાવી આપવાનો રહેશે જે અંગે જે તે આઈટમ માટેના સેન્ટ્રલ સ્ટોર (એજન્સીયરીંગ) ના ભાવ જેની પર કોન્ટ્રાક્ટરે ટેન્ડરમાં જણાવેલ ભાવના ઓછા કે વધુ ટકાની અસર આપવામાં આવશે નહીં.
૦૨. આ કામે હેન્ડ પમ્પ / ડીપવેલને લગત નવો માલ સામાન સેન્ટ્રલ સ્ટોર કે અન્ય સ્ટોર કે પેટ્રોલ પમ્પ પરથી હેન્ડ પમ્પ રીપેર વિભાગ પર લાવવા કે જુનો માલ જમા કરાવવા માટે તેમજ ફાઉન્ડેશન બનાવવા જરૂરી મટીરીયલ લાવવા લઈ જવા, સ્ટાર્ટર / પેનલ તથા કોઈ પણ જરૂરી માલ સામાન લઈ જવા માટે વોટર વર્ક્સ શાખાના એસ.ઓ.આર. મુજબ ધોરણસરનું ભાડું ચુકવવામાં આવશે હેન્ડ પમ્પ રીપેરીંગના સ્ટાફે ભાડુ ચુકવેલ હશે તો તેમને કે કોન્ટ્રાક્ટરે ચુકવેલ હોય તો તેના બીલમાં આકારીને ચુકવવામાં આવશે.
૦૩. દરરોજ હેન્ડ પમ્પ વિભાગ દ્વારા સુચના અપાય તે સ્થળોએ સુચના મુજબ હેન્ડ પમ્પ કે ડીપવેલ પમ્પ રીપેર કરી આપવાનો રહેશે.
૦૪. એ. હેન્ડ પમ્પ/ડીપવેલ પમ્પ રીપેરીંગ કામ દર રોજ ઓછામાં ઓછા છ માણસો કોન્ટ્રાક્ટરે કામ પર રાખવાના છે. તેમજ વધુ કામ પ્રમાણે વધુ માણસો રાખવાની સુચના મુજબ તે પ્રમાણે કારીગરો વધારવાના રહેશે.
- બી. હેન્ડ પમ્પ / ડીપવેલને લગત મીકેનિકલ કામો કે ડીપવેલ / બોરવેલને લગત ઈલે. કામો માટેની એજન્સીએ નાયબ કાર્યપાલક ઇજનેરની સુચના મુજબ અનુભવી કારીગરો પાસે કામગીરી કરાવવાની રહેશે.
૦૫. ડીપવેલ પમ્પમાં જમીન ઉપરના ભાગે બોડીમાં રીપેર કરવાનાં કામના ફક્ત પાણીને લગત સેલ-પાઈપ યુનિટમાં જ રીપેરીંગ કામ કરવાનું છે. ગીયર બોક્સ કે ઈલેક્ટ્રીકલ કામ કરવાનું નથી. હેન્ડ પમ્પ કે ડીપવેલ પમ્પમાં પાણીને લગત મીકેનિકલ રીપેર કામો કરવાના છે.
૦૬. અ. આ કામ માટે જરૂરી તમામ પ્રકારના હથિયારો ઓઝારો વિગેરે સાધન સામગ્રી કોન્ટ્રાક્ટરે પોતાના વાપરવાના રહેશે તથા મહાનગરપાલિકા તરફથી આપવામાં આવેલ તમામ માલ સામાન જિલ્લા ગાર્ડનથી સાઈટ પર લાવવા માટે તથા જુનો માલ પરત જિલ્લા ગાર્ડન લાવવા માટે વાહન કોન્ટ્રાક્ટરે પોતાનું વાપરવાનું રહેશે જેનો અલગથી કોઈ ભાવ આપવામાં આવશે નહીં.
- બી. આ કામે સ્ટોરમાંથી જરૂરી માલ સામાન લાવવા માટે ઈન્ટેન્ટ આ કામના ભાવ મંજૂર થયા હોય તે એજન્સીના નામનું કાઢવામાં આવશે તેમજ સ્ટોર ઉપરથી માલ સામાન લાવવાની, જુનો માલ સામાન નાયબ કાર્યપાલક ઇજનેરની સુચના અન્વયે સ્ટોરમાં જમા કરાવવાની સઘળી જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.

- ક. મહાનગરપાલિકાએ આપેલ માલ સામાન ખોવાઈ જવા/ઓછા થવા અંગેની જવાબદારીકોન્ટ્રાક્ટરની રહેશે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી માગે ત્યારે માલ સામાનનો સ્ટોકની વિગત આપવાની રહેશે. માલ સામાનમાં ઘટ પડયે સેન્ટ્રલ સ્ટોર્સ (એન્જી.) ના ખરીદ ભાવ પ્રમાણે નિયમાનુસાર વસુલાત કોન્ટ્રાક્ટરશ્રીના બીલમાંથી કપાત કરવામાં આવશે.
૦૭. કોઈ લોકેશન ઉપર હેન્ડ પમ્પ ઉચો ઉપાડવાનો થાય તેવા સંજોગોમાં જરૂરીયાત મુજબ મોરમની ભરતી કરી સુચના મુજબનું લેવલ કરવા માટે જરૂરી મોરમ માટેનું જે તે સમયે પ્રવર્તમાન બાંધકામ શાખાના એસ.ઓ. આર. મુજબ જે તે વોર્ડ ના ભાવે ચુકવણું કરવામાં આવશે.

ઉપરોક્ત જનરલ સમજૂતી સિવાય ટેન્ડરમાં આપેલ અન્ય તમામ શરતોને આધિન રહીને કામ કરી આપવાનું રહેશે.

નાઇઝાં	નાઇઝાં	નાઇઝાં	નાઇઝાં	નાઇઝાં	નાઇઝાં
રૈયાધાર વે ડું	ન્યારી વે ડું	આજી	બેડી	ભાદર સે ડું	હેન્ડ પમ્પ "
ઢો	ઢો	ઇઢો ડું	ઇઢો ડું	ઢો	બોરવેલ

એડીસીટી એન્જિનિયર .
રાજકોટ મહાનગરપાલિકા